

Joint Press Release on First Meeting of India-Maldives Joint Working Group on Counter Terrorism, Countering Violent Extremism and De-Radicalisation

April 08, 2021

આતંકવાદનો સામનો કરવા, હિંસક ઉગ્રવાદ અટકાવવા અને કટ્ટરપંથને ઘટાડવા અંગે ભારત-માલદિવની સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક અંગે સંયુક્ત અખબારી યાદી

8 એપ્રિલ, 2021

ભારત અને માલદિવ વચ્ચે આતંકવાદનો સામનો કરવા, હિંસક ઉગ્રવાદને અટકાવવા અને કટ્ટરપંથને ઘટાડવા માટે 8મી એપ્રિલ, 2021ના રોજ સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાઈ હતી.

વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) શ્રી વિકાસસ્વરૂપના વડપણમાં ભારતીય પક્ષે આ બેઠકમાં ભાગ લીધો હતો, જ્યારે માલદિવ પક્ષનું નેતૃત્વ વિદેશ સચિવ અબ્દુલ ગફૂર મોહમ્મદે કર્યું હતું. બન્ને દેશ વચ્ચે આ બેઠક મૈત્રીપૂર્ણ અને રચનાત્મક માહોલમાં યોજાઈ હતી. ભારત અને માલદિવ પડોશી દેશો વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના વડપણ હેઠળ આપણા સંબંધોમાં ઉર્જા, મહત્વકાંક્ષાને વેગ મળ્યો છે તેમ જ સંબંધો નવી ઉંચાઈ પર પહોંચ્યા છે.

ભારત અને માલદિવે સરહદ પારના આતંકવાદ સહિતના આતંકવાદના તમામ સ્વરૂપની આકરી ટીકા કરી હતી. બન્ને દેશોએ આતંકવાદ સામે લડવા સર્વગ્રાહી અને ટકાઉ પદ્ધતિથી આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત કરવા પર ભાર મુક્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા જે આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે તેમની તરફથી રહેલા જોખમ અંગે પણ બન્ને દેશો દ્વારા સમિક્ષા કરવામાં આવી હતી અને તમામ આતંકવાદી નેટવર્ક સામે કડક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તમામ દેશો પોતાના ભૌગોલિક પ્રદેશો અને સરહદનો અન્ય દેશો પર આતંકવાદી હુમલા કરવા ઉપયોગ ન કરવામાં આવે તેની ખાતરી કરવા તાત્કાલિક કડક પગલાં ભરે અને આ પ્રકારના હુમલા કરનારા ગુનેગારો સામે કાર્યવાહી કરી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મુક્યો હતો.

જૂન, 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદિવના પ્રવાસ પર ગયા હતા તે દરમિયાન જાહેર કરવામાં

આવેલા સંયુક્ત નિવેદનને ટાંકી બન્ને દેશોએ આ વિસ્તારમાં શાંતિ તથા સુરક્ષા આતંકવાદનો સામનો કરવા, હિંસક ઉગ્રવાદને અટકાવવા અને કટ્ટરપંથને ઘટાડવા તેમની તરફથી રહેલા મહત્વના જોખમોની ઓળખ કરી હતી.

બન્ને પક્ષોએ કટ્ટરતાનો સામનો કરવા, હિંસક ઉગ્રવાદ, આતંકવાદને મળતા ભંડોળ સામે લડવા, આતંકવાદ માટે ઈન્ટનેટના ઉપયોગને અટકાવવા તથા હિંસક કટ્ટરતા સામે લડવા, માહિતીનું આદાન પ્રદાન કરવા અને પોલીસ, સુરક્ષા દળો, કસ્ટમ્સ, ઈમિગ્રેશન અને અન્ય સંબંધિત એજન્સીઓ વચ્ચે ક્ષમતા નિર્માણ તથા સંસ્થાગત જોડાણો કરવા સહિત વિવિધ ક્ષેત્રમાં સહકાર કરવા વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ ઉપરાંત બન્ને દેશોએ માદક પદાર્થો અને ડ્રગ્સની હેરાફેરી સામે દ્વિપક્ષીય સહકારને વધારવા અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. આતંકવાદ, કટ્ટરપંથી અને હિંસક ઉગ્રવાદ સામેની લડાઈમાં કોવિડ-19ની મહામારીએ કેવા પડકારોનું સર્જન કર્યું છે તે અંગે પણ ચર્ચા કરી હતી.

બન્ને પક્ષો દ્વિપક્ષી સહકાર મજબૂત કરવા સહમત થયા હતા, સુરક્ષા તથા કાયદાનો અમલ કરતી એજન્સીઓ અને માલદિવની અન્ય એજન્સીઓ સાથે સહકાર કેળવવા અને ક્ષમતાનું નિર્માણ કરવા તથા આતંકવાદ સામે લડવા, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરપંથીઓનો સામનો કરવાનો સમાવેશ થાય છે. બહુપક્ષીય મંચોમાં સહકાર કરવા અંગે પણ બન્ને પક્ષોએ ચર્ચા કરી હતી.

માલદિવનું પ્રતિનિધિ મંડળ નેશનલ સિક્યુરિટી ગાર્ડની તાલીમ સુવિધા તથા દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પણ મુલાકાત લેશે.

નવી દિલ્હી

08 એપ્રિલ, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.